

2019 કમ્યુનિટી ગ્રાન્ટ પ્રોગ્રામ (સામુદાયિક અનુદાન કાર્યક્રમ) મારફતે બ્રામ્પટનમાં રોકાણ કરવું

આ શહેરમાંથી નેવું જેટલી સમુદાય-આધારિત સંસ્થાઓને અનુદાન ભંડોળ માટે મંજૂરી મળી.

બ્રામ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 3, 2019) – બ્રામ્પટન સીટી કાઉન્સિલે 2019 કમ્યુનિટી ગ્રાન્ટ પ્રોગ્રામ (સામુદાયિક અનુદાન કાર્યક્રમ) મારફતે ભંડોળ માટે 90 અરજીઓ મંજૂર કરી છે. આ સંખ્યા વર્ષ 2018 કરતા મંજૂરી મેળવનાર અરજીકર્તાઓની સંખ્યાથી બમણીથી વધારે છે, જ્યારે 34 પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામ્સને અનુદાન મળ્યું.

ડિસેમ્બર 13, 2018 થી જાન્યુઆરી 31, 2019 નાં સમયગાળા દરમિયાન કુલ 106 અનુદાન દરખાસ્તો મળી હતી, જે ગયા વર્ષમાં રજૂ થયેલી અરજીઓમાં 74 ટકાનો વધારો દર્શાવે છે. મંજૂર થયેલી ગ્રાન્ટ્સનું કુલ ભંડોળ મૂલ્ય \$1,530,752.79 છે, જે \$967,000 નાં પાયાના સંચાલન અંદાજપત્ર કરતા વધારે છે. વધારાનું ભંડોળ કમ્યુનિટી ગ્રાન્ટ્સ સરપ્લસ રિઝર્વમાંથી મેળવવામાં આવશે.

કમ્યુનિટી ગ્રાન્ટ પ્રોગ્રામ પાત્ર સંસ્થાઓને તેઓના આયોજનના કે કાર્યક્રમના હેતુઓ હાસલ કરવા સહાયતા, સંસ્થાગત ક્ષમતા ઊભી કરવા અને સમુદાય રચનામાં અને બ્રામ્પટનની સાંસ્કૃતિક ઓળખમાં ફાળો પૂરો પાડે છે. ભંડોળ તહેવારો અને આયોજનો, કળા અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતોલક્ષી પર્યટન આયોજન, અને મનોરંજનલક્ષી અને સક્રિય જીવન માટે ઉપલબ્ધ છે. પાડોશમાં પહેલો માટેની ભંડોળ શ્રેણી પણ છે, જે કેલેન્ડર વર્ષના અંત સુધી અથવા તમામ ભંડોળ વપરાઈ જાય ત્યાં સુધી દર મહિને અરજીઓ સ્વીકારવાનું ચાલુ રાખે છે.

“બ્રામ્પટનમાં જીવનના તમામ પહેલુઓ સુધારવા મહત્વનું કામ કરી રહી હોય તેવી સામુદાયિક સંસ્થાઓની વૈવિધ્યસભર શ્રેણી આપણાં શહેરમાં છે. કમ્યુનિટી ગ્રાન્ટ પ્રોગ્રામ મારફતે, અમે આ સંસ્થાઓને સહાયતા કરવા, ભાગીદારીઓ ઊભી કરવા અને બ્રામ્પટનમાં કલ્ચરલ મોઝેઈકને ફાળો આપવા બહુ રાજી છીએ,” મેયર પેટ્રિક બ્રાઉને (Patrick Brown) કહ્યું.

તમામ અરજીકર્તાઓનો સંપર્ક તેઓની દરખાસ્તની સ્થિતિના સંબંધમાં અને મંજૂરી મેળવનાર ગ્રાન્ટ મેળવનારાઓ સાથે ગ્રાન્ટ કરારોનો સહયોગ સાધવા કરવામાં આવશે. આ શહેર હાલમાં કમ્યુનિટી ગ્રાન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરી રહ્યું છે અને આ કાર્યક્રમ કેવી રીતે ભવિષ્યના વર્ષો માટે સામુદાયિક જરૂરિયાત સામે સહાનુભૂતિ રાખી શકે છે તે વિશે આ વર્ષના અરજીકર્તાઓ અને સામુદાયિક ભાગીદારો પાસેથી પ્રતિભાવ મેળવવાની આશા રાખે છે.

મંજૂરી મેળવનાર ગ્રાન્ટ મેળવનારાઓની પૂરી યાદી માટે, કમ્યુનિટી ગ્રાન્ટ પ્રોગ્રામ વિશે વધુ માહિતી માટે, અથવા પાડોશ પહેલો (નેબરહૂડ ઇનિશિએટિવ્સ) સંબંધિત ભંડોળ પ્રવાહ માટે અરજી કરવા, વેબસાઈટ જુઓ www.brampton.ca/communitygrants.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अँड कम्युनिटी एंगेजमेन्ट

व्युत्पत्तिक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca